

સુરત ગ્રામ્ય ઓલપાડ પોલીસ સ્ટેશનમાં આજથી એક મહિના પહેલા બનેલ રૂ. ૩૧ લાખની લુંટના ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપીને ઝડપી પાડતી, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ.

સુરત શહેર વિસ્તારમાં બનેલ બનાવોના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન HC હરીસિંહ વિરસંગભાઈ તથા HC હરપાલસિંહ જશુભા નાઓને મળેલ બાતમી આધારે સુરત ગ્રામ્ય ઓલપાડ પો.સ્ટે. I ગુ.ર.નં-૧૧૩/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૯૪,૩૨૮,૩૨૩,૧૧૪ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી રાહુલ ઉર્ફે મેક્સી હસમુખભાઈ કહાર ઉ.વ-૨૭ રહે-હાલ ૩૦૧, સાંઈકૃતી એપાર્ટમેન્ટ સંતતુકારામ સોસા., વિભાગ-૬, પાલનપુર જકાતનાકા અડાજણ, સુરત મુળ રહે-નાનપુરા માછીવાડ મસ્જીદ વાળી ગલી ઘર નં-૧/૨૪૫૦, સુરત વાળાને ઝડપી પાડી પુછપરછ કરતા આ ગુન્હાના મુખ્ય સુત્રધાર આરોપી વિપુલ જોગેન્દ્ર કહાર રહે-નાનપુરા હિજડવાડ ચાર રસ્તા ખાડીમાં સુરત વાળાએ ઓલપાડ તાલુકાના કાછોલ ગામની સીમમાં પોતાની ૧૩ વિંઘા જમીન ઓછા ભાવે વેચી દેવાના બહાને બાનુ આપવા માટે નરથાણ શાંતી એશીયેટીક ઈન્ટરનેશનલ સ્કુલના ખેતરાળી વાળા રોડે બોલાવી ફરી.શ્રી તથા સાહેદો બીકેનભાઈ નાઓના ચેહરા ઉપર સ્પ્રે છાંટી રૂ. ૩૧ લાખની લુંટ કરી નાશી ગયેલ. જે ગુનામાં હાલ પકડાયેલ આરોપી છેલ્લા એક મહિનાથી નાસતો ફરતો હોય તેને પકડી પાડી નીચે મુજબના ગુન્હાઓમાં પકડાય ચુકેલ છે.

(૧) રાંદેર પો.સ્ટે. I ગુ.ર.નં. ૭૦/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૩૬૫, ૩૯૪, ૧૨૦બી, ૧૧૪ મુજબ (૨) અડાજણ પો.સ્ટે. II ગુ.ર.નં-૩૦૪/૨૦૧૬ ઈ.પી.કો. કલમ ૨૭૯ મુજબ (૩) અઠવા પો.સ્ટે. I ગુ.ર.નં-૬૮/૨૦૧૬ ઈ.પી.કો. કલમ ૨૭૯ મુજબ (૪)પારડી પો.સ્ટે. III ગુ.ર.નં-૧૮૭/૨૦૧૭ પ્રોહી. એક્ટ કલમ ૮૫(૧)૩ મુજબ (૫)અડાજણ પો.સ્ટે. III ગુ.ર.નં-૩૧૩/૨૦૧૭ પ્રોહી. એક્ટ કલમ ૮૫(૧)૩ મુજબ (૬)અડાજણ પો.સ્ટે. I ગુ.ર.નં-૮૬/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૧૪૩. ૧૪૪. ૧૪૭.૧૪૮.૧૪૯.૩૦૭.૩૨૪.૩૨૫.૩૩૭,૪૨૭ મુજબ (૭)અડાજણ પો.સ્ટે. I ગુ.ર.નં-૮૭/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૧૪૩.૧૪૭.૧૪૯૩૨૩ મુજબ (૮)ઉમરા પો.સ્ટે. I ગુ.ર.નં-૨૮૬/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૧૧૫, ૧૨૦બી મુજબ (૯)ચોકબજાર પો.સ્ટે. I ગુ.ર.નં-૧૨૯/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૧૪૩.૧૪૪.૩૨૩.૩૪૧.૪૨૭.૫૦૪, ૫૦૬(૨), ૧૨૦બી મુજબ .